

રાજકોટ મહાનગરપાલિકા

ડો.આંબેડકર ભવન ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

--: અખબારી યાદી :-

અભિલેખાગાર કચેરી અને હાઇરાઇઝ બિલ્ડીંગ ક્ષિત્રા સ્કવેરમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

તારીખ: ૦૬-૦૩-૨૦૨૩



રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ અભિલેખાગાર કચેરી, રીડ ક્લબ રોડ, શ્રોફ રોડ, જીલ્લા સેવા સદન - ૩ પાસે, (૨) તા.૦૫/૦૩/૨૦૨૩ નાં રોજ ક્ષિત્રા સ્કવેર ૪ વિંગ એ + બી, નવો ૪૦ ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, રાજકોટ ખાતે

ચીફ ફાયર ઓફીસરશ્રી આઈ . વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી . જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફ્ટી અંગે મોકડૂલીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફ્ટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડૂલીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફ્ટીની તાલીમ દરમ્યાન (૧) અભિલેખાગાર કચેરી, રીડ કલબ રોડ, શ્રોફ રોડ, જીલ્લા સેવા સદન – ૩ પાસે, રાજકોટ કચેરીના અંદાજે ૫ થી ૧૦ જેટલા અધિકારીશ્રી / કર્મચારીઓ (૨) (૨) તા.૦૫/૦૩/૨૦૨૩ નાં રોજ ક્રિશ્ના સ્ક્વેર ૪ વિંગ એ + બી, નવો ૪૦ ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, રાજકોટ હાઈરાઈઝ બિલ્ડીંગના ૫૦ થી ૬૦ રહેવાસીઓ આ મોકડૂલીલમાં જોડાયેલ . જે મોકડૂલીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) અભિલેખાગાર કચેરી ખાતે સ્ટેશન ઓફીસરશ્રી એસ.આર.નડીયાપરા, ફાયરમેન કમલેશ ઝંઝવાડીયા, રવજી સોલંકી, અજય પરમાર, ભાવેશ વડેખણીયા ડ્રાઈવર વિશાલભાઈ ઘટાર તથા (૨) ક્રિશ્ના સ્ક્વેર ૪ વિંગ એ + બી સ્ટેશન ઓફીસર શ્રી વાય ડી જાની, લીડીંગ ફાયરમેન જયેશભાઈ દાણીધારીયા, ફાયરમેન અનિલભાઈ, મનસુખ વડેખણીયા ડ્રાઈવર ભવદીપભાઈ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્સટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો , જાળવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા